



ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

રાજીવ ગાંધી ભવન” સંસ્કાર કેન્દ્ર માર્ગ, વી.એસ. હોસ્પિટલ પાસે, એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬.
ફોન : ૦૭૯-૨૬૫૭૮૨૧૨-૨૧૩, ૨૬૫૭૮૧૬૧, ૨૬૫૭૮૩૧૧ ફેક્સ : ૦૭૯-૨૬૫૭૮૫૮૯

Web : www.gujaratcongress.org

E – mail : gpcc1234@gmail.com

અખબારી યાદી


તા. ૦૯-૧૨-૨૦૧૭

ગુજરાત વિધાનસભા - ૨૦૧૭ ની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે મતદાન પૂર્ણ થયા બાદ રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આજ રોજ પ્રથમ ચરણના ૮૯ વિધાનસભાના ૨ કરોડ ૧૨ લાખ ચૂંટણી મતદારો પૈકી ૬૫ ટકા જેટલું મતદાન કરવા બદલ કોંગ્રેસ પક્ષ વતી મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અને પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીમાં ૬૫ થી ૭૦ ટકાની આસપાસ જંગી મતદાન થવાની સંભાવના કરવામાં આવે છે. આવા જંગી મતદાનથી એ તો નક્કી થઈ ગયું કે, ગુજરાતની ૬.૫ કરોડ જનતા ૨૨ વર્ષથી શાસન કરતી ભાજપ સરકારથી ત્રસ્ત થઈ ગઈ છે. ભાજપ સરકારના દમન, ઝુમલા, ખોટા વાયદા થી કંટાળી ગઈ છે. માટે ગુજરાતની ૬.૫ કરોડ જનતાએ નક્કી કરી લીધું છે કે, દરેક નાગરિકે મતદાન કરીને આ ઝુમલાની ભાજપ સરકારને ધરભેગી કરવી છે.

ભાજપ સરકારના પ્રવક્તા સંબીત પાત્રા એ ગુજરાતની માટીના લાલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કર્યું છે. પૂ. મહાત્મા ગાંધી ફક્ત કોંગ્રેસના નેતા નહીં પરંતુ સમગ્ર દેશના રાષ્ટ્રપિતા છે. મોદીજીએ મહાત્મા ગાંધી બનવા માટે આઝાદી જંગની લડાઈ લડવી પડે, દેશની જનતા માટે દેશની જનતાને અંગ્રેજોથી આઝાદી અપાવવા માટે જેલમાં જવું પડશે. જે મોદીજી માટે શક્ય નથી. મોદીજી દેશની જનતાના પૈસાથી સરકારી તિજોરી ખાલી કરીને વિદેશ પ્રવાસ કરી શકે છે. પણ દેશની જનતા માટે ખુદ પર કોઈ પીડા સહન કરવાની મોદીજીમાં શક્તિ નથી. મોદીજી માટે ફક્ત બોલવું સહેલું છે. પરંતુ તેના પર અમલ કરવો મોદીજી માટે અશક્ય છે.

સરદાર પટેલજીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના મૃત્યુ માટે રાષ્ટ્રીય સ્વયં સેવક-વિચારધારા જવાબદાર છે. ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના બુધ બનાવવામાં આવી રહ્યાં છે. તેમના મંદિર બનાવવામાં આવી રહ્યાં છે. મધ્ય પ્રદેશમાં તેમને મહાન ગણવામાં આવી રહ્યાં છે. રાષ્ટ્રીય સ્વયં સેવકની વિચારધારાના કારણે જ મહાત્મા ગાંધીજીનું મૃત્યુ થયું. છેલ્લા ૭૦ વર્ષમાં આજદિન સુધી કોઈ પણ પક્ષ કે નેતા કે પછી દેશનો સામાન્ય નાગરિક હોય પરંતુ આજદિન સુધી કોઈએ પણ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અપમાન કરવાનું અપરાધ નથી કર્યું. જે અપમાન મોદીજીની ભાજપા સરકારના પ્રવક્તાએ કર્યું. મોદીજી ભાજપના પ્રવક્તાને સસ્પેન્ડ કરે નહીંતર એવું સાબિત થઈ શકે છે કે, મહાત્મા ગાંધીજીનું અપમાન કરવા પાછળ પ્રધાનમંત્રી મોદીજીનું ષડયંત્ર તો નથી ને. ભાજપ પ્રવક્તા મોદીજીના આદેશ પર જ સમજી વિચારીને સુયોજિત ષડયંત્ર કર્યું હોય તેવું જણાવી આવે છે.

ભાજપના પ્રવક્તાએ દેશના લાલ રાષ્ટ્રપિતાનું અપમાન કરી સમગ્ર દેશનું અપમાન કર્યું છે. આ અપરાધજનક ગુન્હા બદલ મોદીજી અને ભાજપ સરકાર સમગ્ર દેશની માફી માંગે અને આમા જે પણ અપરાધી છે તે પ્રવક્તાને ભાજપ સરકાર પોતાની પાર્ટીમાંથી સસ્પેન્ડ કરે.


(ડૉ. મનિષ એમ. દોશી)
પ્રવક્તા